https://archive.org/details/bk1409/page/n0/mode/1up

2013-06 -Satpanth Prakash (1409)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૨, અંક : ૪, સળંગ અંક : ૧૬ દર માસની ૧૫ તારીખે પ્રસિદ્ધ થતું માસિક જુન : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

છૂટક કિંમત - રૂા. ૭/- વા.લ. રૂા. ૮૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1409/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 4, 5, 8.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1409/page/n2/mode/1up

2013-06 -Satpanth Prakash (1409)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:55:27 +05'30'

Real Patidar
Unravel Truth

realpatidar.com

વર્ષ : ૨, અંક : ૪, સળંગ અંક : ૧૬ દર માસની ૧૫ તારીખે પ્રસિદ્ધ થતું માસિક જુન : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

છૂટક કિંમત - રૂા. ૭/- વા.લ. રૂા. ૮૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1409/page/n3/mode/1up

Amagadh
Satpanth Temple

realpatidar.com

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મુ. અમરગઢકંપા, તા. ધનસુરા, જી. સાબરકાંઠા. (તા. ૩-૪-૨૦૧૩)

ઉપરોક્ત પ્રસંગે સંતોનાં ભવ્ય સ્વાગત - શોભાયાત્રા

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સંતો - મહંતો - મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં ધર્મલાભ લેતા ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા, આદ્યશક્તિ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ પ્રાણ પ્રતિષ્ઠા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરી રહેલ છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1409/page/n4/mode/1up

Lalpura Kampa Temple

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભ[illegible] પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મુ. લાલપુર કંપા, તા. મોડાસા, જી. સાબરકાંઠા. (તા. ૧૬-૫-૨૦૧૩)

realpatidar.com

ઉપરોક્ત પ્રસંગે સંતોનાં ભવ્ય સ્વાગત - સામૈયાં - શોભાયાત્રા

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સંતો - મહંતો - મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે વિષ્ણુયાગ મહાયજ્ઞ

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા, આદ્યશક્તિ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ પ્રાણ પ્રતિષ્ઠા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરી રહેલ છે.

realpatidar.com

https://archive.org/details/bk1409/page/n5/mode/1up

Gota Kampa

realpatidar.com

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મુ. ગોતા કંપા, તા. ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા. (તા. ૨૦-૫-૨૦૧૩)

ઉપરોક્ત પ્રસંગે સંતોનાં ભવ્ય સ્વાગત - સામૈયાં - શોભાયાત્રા

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સંતો - મહંતો - મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે વિષ્ણુયાગ મહાયજ્ઞ

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા, આધશક્તિ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ, ત્રિદેવ પ્રાણ પ્રતિષ્ઠા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરી રહેલ છે.

realpatidar.com

https://archive.org/details/bk1409/page/n6/mode/1up

2013-06 -Satpanth Prakash (1409)

Teachings of Imamshah
realpatidar.com

સદ્‌ગુરુ વચનામૃત

- હંસરાજભાઈ ગો. પટેલ - મેઘપુરાકંપા.

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે :

સંસારસું સરસો રહે ને મન રહે મારી પાસ ।
સંસારમાં લોપાય નહીં, તેણે જાણું મારો દાસ ॥
જલમાંહે વસે રે કમલની, ઉદકે પ્રવેશ ના થાયે ।
એવા ચિહ્ન મારા દાસનાં, હું તો કહું છું નિરધાર ॥

વળી સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કહે છે કે :

"સંસાર સાગર સકલ છે જૂઠો, મત જાણો હૈ મેરા રે ।
છોડીને ભ્રમ તમે બ્રહ્મ પિછાનો, ખોજ અંતરઘટ તેરા રે ॥"

સંસારની નાશવંત બાબતોથી દૂર રહેવું, રાત-દિવસ પુરુષોત્તમને ઠેકાણે એક નિષ્ઠ રહેવું, પાણીમાં રહી પાણીથી અલિપ્ત રહેનાર કમળ પ્રમાણે જીવાત્માએ સંસાર-સાગરમાં રહી અલિપ્ત રહેવું. પાણીમાં હોવા છતાં કમળની પાંખડીઓને પાણીનો સ્પર્શ થતો નથી, એટલું જ નહીં પણ પાણીના બિંદુ પાંખડીઓ ઉપર પડે તો પણ તે ખરી પડે છે તે પ્રમાણે જીવાત્માએ સંસારમાં અલિપ્ત રહેવું. સંસારમાં સ્ત્રી - પુત્રાદિકની આસક્તિ ન રાખતાં અલિપ્ત રહેવું, એટલે જ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, વિકાર જીતવા એ જ ખરી વિરક્તિ છે, પણ જીવ 'સત્' કરતાં અસત્‌માં જ રાચ્યો રહે છે. મૂઢ માણસ સંસારમાં આ મારો દેહ, આ મારી સ્ત્રી, મારો પુત્ર, મારો નોકર, મારું ધન, વગેરે બધું મારું જ છે એ રીતે હું અને મારું એ મમત્વમાં જ બધ્ધ થઈ તેમાં જ લીન થઈ જાય છે, અને પોતાની કિંમતી જીંદગી માંસના પૂતળાની (દેહની) સેવામાં વેડફી નાખે છે. થોડા સંસ્કાર પામેલો પુરુષ પૂજન અર્ચનના આડંબરમાં સમય ગુમાવે છે અને વધુ સંસ્કારી માણસ યજ્ઞયાગ કરી સ્વર્ગાદિ ફળ પ્રાપ્તિની ઈચ્છા કરે છે, પણ આવા ફળની આશાથી કરેલાં કર્મો ફોગટ જાય છે. આ તો અસત્‌નો ફેરો કહેવાય. કારણ સ્વર્ગ સુખ મળે તો પણ જન્મ-મરણના ફેરા ટળતા નથી. જેના લીધે બધા વ્યવહારમાં કુશળતા મળે અને ભવસંબંધના પાશમાંથી મુક્ત થઈ જન્મ-મરણના ફેરા ટળે તે પરબ્રહ્મ પરમાત્મા એટલે 'સત્' ની શોધમાં કોઈનું ચિત્ત ચોંટતું નથી. હજારો કે લાખોમાંથી એકાદો જ આ માર્ગને અપનાવે છે. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કહે છે કે ;

ઝવેરી હોય તો પારખે, અને હીરા ચૌટે બજાર ।
મુનિવર હોવે તો પારખે, જ્ઞાનની સુરતી લગાય રે ॥

જેમ ખરા હીરાને પારખનાર ઝવેરી જુજ હોય છે તેમ સાચો મુનિવર તે જ જ્ઞાનરૂપી કસોટીથી પરમેશ્વરને જાણી શકે છે. અન્યથા મોહમાં ફસાયેલા બીજા લોકો તેને ઓળખી શકતા નથી. પુત્રાદી ઉપર જેમની આત્મબુધ્ધિ હોય છે તે પામર છે. જે પામર તેમનું સુખદુઃખ તે જ પોતાનું માને છે તે તો અલ્પજ્ઞ અને મૂઢ કહેવાય. આ નાશવંત શરીરનો અભિમાની માણસ નિર્જળ ભૂમિમાં પાણીની આશા સેવતા મૃગ જેવો છે. વ્રત નિયમોથી શરીરને સજા કરવાથી અમૃત મળશે પણ વિષય સેવનથી તેનું પોષણ કરવાથી કેવળ ઝેર જ મળવાનું છે. મનુષ્યને સત્‌થી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્તિ કરી લેવાની છે તેણે બીજા કોની ઉપાસના કરવી નહીં. જેને શેરડીની મીઠાશ જોઈએ છે તેણે બાવળ કે બોરડીનું સેવન કરવું નિરર્થક છે. સત્‌ની પ્રાપ્તિ માટે અહંકારનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરી સંયમથી ચિત્તવૃત્તિનો નિરોધ કરી પ્રેમી થવું જોઈએ. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કહે છે ;

પ્રીત પીયુ સું જે કરે, એક પલ ના પડે ભૂલ ।
કનક કસોટી જે સહે, તે પામે મોલ અમૂલ ॥
પ્રીત લાગી કેમ જાણીએ, જેણે પાંચે તત્વ કીધા વશ ।
કામ ક્રોધ જેણે વશ કર્યા, તેના તન ચડિયા કશ ॥

પ્રેમ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. પ્રેમ સિવાય ભક્તિ ન થઈ શકે. જરા પણ ભૂલ કર્યા વગર ઈશ્વરની જે પ્રેમભાવથી ભક્તિ કરે છે તે સુવર્ણની જેમ કસોટીએ ઊતરે છે. કામ, ક્રોધ અને લોભ એ ત્રણને જીતનાર બાકીના ત્રણ સહેલાઈથી જીતી શકે

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 5 of 9

https://archive.org/details/bk1409/page/n7/mode/1up

2013-06 -Satpanth Prakash (1409)

realpatidar.com

છે. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કહે છે ;

જીવ્યા ઇંદ્રિય જે વશ, તે ઉતરી ગયા પાર ।
કામ, ક્રોધ જે નર ભુલીયા, તેનો એળે ગયો અવતાર રે ॥
લોભ, સવારથે જીવ બુડીયો, અને ગફલત બુડો ગેમાર ॥

કામ, ક્રોધ લોભ વગેરે વિકારોના કારણે જે જીવ ઈશ્વરભક્તિથી વંચિત રહ્યો તેનો જન્મ નિષ્ફળ કહેવાય. એવા લોકો પૃથ્વી ઉપર ભારરૂપે પશુ સમાન છે. માત્ર મનુષ્ય રૂપે તે ફરે છે એટલું જ. ભગવદ્‌ગીતામાં કહ્યું છે !

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
काम क्रोध स्तथा लोभस्त मादेतत्रयं त्यजेत् ॥

કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકનાં દ્વાર પોતાનો નાશ કરનારાં છે. માટે એ ત્રણેનો ત્યાગ કરવો. જે કામ ક્રોધાદિ ષડ્‌રિપૂને જીતે છે તેને પંચતત્ત્વો વશ થાય છે અને એવા જ માણસને સત્‌નું દર્શન થાય છે. એના માટે પ્રેમભક્તિની અત્યંત જરૂર છે. ●●●

સર્વદેવ ઋષિવરને નમસ્કારનો મંત્ર વિસ્તારથી

- સંકલન : કે. વી. પટેલ - બુટાલકંપા.

(એપ્રિલ - ૨૦૧૩ના ગતાંકથી ચાલે...)

૫૧. પાંચ કરોડી પ્રહલાદને નમસ્કાર : વિષ્ણુ ભગવાન ચોથા નરસિંહ અવતાર વખતે તે વખતના દાનવ રાજા હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ, ખૂબ પ્રભુ ભક્ત હતા. તેના પિતાએ તેને વિષ્ણુનું નામ ન લેવા આજ્ઞા કરી, પરંતુ ભક્ત પ્રહલાદે વિષ્ણુ ભગવાનનું સ્મરણ ચાલુ જ રાખ્યું. તેથી તેના પિતાએ ભક્ત પ્રહલાદને ખૂબ જ હેરાન કર્યા અને છેલ્લે ધગધગતા લોખંડના થાંભલાને બાથ ભીડવાનું કહ્યું. ભક્ત પ્રહલાદને વિષ્ણુ ભગવાન ઉપર ખૂબ જ શ્રધ્ધા હતી, તેથી ભક્ત પ્રહલાદે ધગધગતા થાંભલાને બાથ ભીડી. ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થઈને ભક્ત પ્રહલાદનો ઉધ્ધાર કર્યો. ભક્ત પ્રહલાદે પછી બધાને સત્‌પંથ ધર્મનું જ્ઞાન આપ્યું. ઘણા સ્થાને ઋષિમુનિઓના આશ્રમો, વિદ્યાપીઠો સ્થાપી જ્ઞાન સાધના અને ભક્તિ સાધના શરૂ કરી. પાંચ કરોડ જીવાત્માનો ઉધ્ધાર કર્યો. એવા પાંચ કરોડી પ્રલાદને નમસ્કાર.

૫૨. સાત કરોડી રાજા હરિશ્ચંદ્રને નમસ્કાર : રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા થઈ ગયા. સત્ માટે રાજા હરિશ્ચંદ્રને ખૂબ જ કષ્ટ પડ્યું. પોતાનું રાજપાટ છોડીને પોતાની પત્નીને વેચી તેમજ પોતાના બાળક રોહીદાસને વેચી નાખ્યો અને પછી પોતે જાતે વેચાઈ ગયા. અંત સમયે રાજા હરિશ્ચંદ્રની ખૂબ જ કસોટી કરાવ્યા પછી તેના ગુરુદેવ તથા પ્રભુ પોતે પ્રગટ થયા અને રાજા હરિશ્ચંદ્રનો ઉધ્ધાર કર્યો. આ રાજા હરિશ્ચંદ્રની સાથે સત્‌પંથના માર્ગે ચાલતાં ચાલતાં સાત કરોડ બીજા જીવાત્માનો ઉધ્ધાર થયો તે તમામ સાત કરોડી રાજા હરિશ્ચંદ્રને નમસ્કાર.

૫૩. નવ કરોડી રાજા યુધિષ્ઠિરને નમસ્કાર : મહાભારતમાં પાંચ પાંડવોના વડીલ બંધુ રાજા યુધિષ્ઠિર થઈ ગયા. પોતાના જીવનમાં કદીય ક્યાંય જુઠું બોલ્યા નથી. જુગાર રમતાં બધું જ હારી ગયા તો પણ કૌરવો સાથે સચ્ચાઈથી વર્તન કરેલ અને યુધિષ્ઠિર મહારાજને પોતાના જીવનમાં સચ્ચાઈ (સત્) માટે ખૂબ જ સહન કરવું પડેલ અને સદેહે સ્વર્ગમાં સીધાવ્યા હતા. આ મહારાજે પોતાની સાથે નવ કરોડી ભક્તોનો ઉધ્ધાર કરેલ હતો તે નવ કરોડી રાજા યુધિષ્ઠિરને નમસ્કાર.

૫૪. બાર કરોડી સદ્‌ગુરુદેવને નમસ્કાર : હાલમાં પ્રવર્તમાન કલિયુગમાં સદ્‌ગુરુશ્રીની સદ્‌વાણીથી, સત્ય કર્મથી બાર કરોડી જીવોનો ઉધ્ધાર થશે. સદ્‌ગુરુના વચનાનુસાર વર્તીને, અનંત અપાર કસોટીઓ પસાર કરતાં કરતાં બાર કરોડી જીવાત્માનો ઉધ્ધાર થશે તેવા બાર કરોડી સદ્‌ગુરુદેવને નમસ્કાર.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 6 of 9
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1409/page/n8/mode/1up

realpatidar.com

૫૫. અનંત કરોડી કમળાકુંવરને નમસ્કાર : સત્‌યુગમાં ભક્ત પ્રહલાદ સાથે પાંચ કોટી જીવાત્મા અમર પદે ગયા, ત્રેતાયુગમાં સદ્દભક્ત રાજા હરિશ્ચંદ્ર સાથે સાત કોટી જીવાત્મા વૈકુંઠમાં ગયા, દ્વાપર યુગમાં સદ્દભક્ત યુધિષ્ઠિર સાથે નવ કોટીનો ઉધ્ધાર થઈ અમર થયા, આજ કલિયુગમાં બ્રહ્મદર્શી એવા સદ્‌ગુરુના માર્ગદર્શનથી બાર કોટી જીવાત્મા દેવગતિ પામીને અમરભૂમિના નિવાસી થશે.

પહેલાના ત્રણ કલ્પમાં અનુક્રમે દશરાયણ કલ્પમાં નવાણું કરોડી યક્ષ, બીજા દેવગુણ કલ્પમાં છપ્પન કરોડ મેઘા, ત્રીજા લીલવગુણ કલ્પમાં બત્રીસ કરોડ કિન્નર એવા જીવાત્મામુક્ત થયા, આજે શ્વેતવેરા કલ્પમાં કલિયુગના છેલ્લા પ્રહરમાં કલ્પના અંતકાળ પહેલાં ભક્ત કમળાકુંવરની સાથે અમરાપુરીના બધા જીવાત્માઓનો મુક્તિનો યોગ થશે. એવા અનંતકરોડી કમળાકુંવરને નમસ્કાર.

૫૬. તેત્રીસ કરોડી દેવતાને નમસ્કાર : સમગ્ર જીવાત્માઓના કલ્યાણ માટે તેત્રીસ કરોડી દેવતાનું ઈશ્વરે સર્જન કરેલ છે. તેવા તેત્રીસ કરોડી દેવતાને નમસ્કાર.

૫૭. સર્વ ઋષિવર ગતગંગાને નમસ્કાર : કોઈપણ નાનું - મોટું ધાર્મિક કાર્ય કરવા માટે ભક્તજનો એકત્ર થાય છે તેમાં જે જ્ઞાની વક્તા (સંતપુરુષ) હોય છે તેને ઋષિવર કહેવામાં આવે છે અને આવા ધાર્મિક મેળાવડામાં જે જ્ઞાની શ્રોતાઓ ઉપસ્થિત હોય છે તેને મુનિવર કહેવામાં આવે છે. એકત્ર થયેલા મુનિવરના સમૂહને ગતગંગા કહેવામાં આવે છે. આવા સર્વ ઋષિવર અને ગતગંગાને નમસ્કાર.

૫૮. દશે અવતારોને નમસ્કાર : માનવજાતના કલ્યાણ માટે તેમજ સમગ્ર જીવાત્માના ઉધ્ધાર માટે તેમજ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યનારાયણશ્રી વિષ્ણુ ભગવાને અલગ અલગ સ્વરૂપે દશ અવતાર ધારણ કર્યા તે (૧) શ્રી મત્સ્ય (૨) શ્રી કૂર્મ, (૩) શ્રી વરાહ, (૪) શ્રી નરસિંહ, (૫) શ્રી વામન, (૬) શ્રી પરશુરામ, (૭) શ્રી રામ, (૮) શ્રી કૃષ્ણ, (૯) શ્રી બુધ્ધ અને હવે (૧૦) શ્રી નિષ્કલંકી અવતાર થવાનો છે તેવા દશે અવતારોને નમસ્કાર.

૫૯. મુખી સેવકને નમસ્કાર : કોઈપણ ધાર્મિક કાર્ય કરવા માટે અને ધાર્મિક કાર્ય જેના સ્વમુખે થાય છે તેને આચાર્ય (મુખી) કહેવામાં આવે છે. આ ધાર્મિક કાર્યને મદદ કરવા માટે જે વ્યક્તિ કાર્ય કરે છે તેને સેવક કહેવામાં આવે છે. આવા આચાર્ય (મુખી) તથા સેવકોને નમસ્કાર.

૬૦. ચૌદ ભુવનના દેવ ઋષિવરોને નમસ્કાર : (૧) ભૂર્લોક (૨) ભુવર્લોક (૩) સ્વર્લોક (૪) મહર્લોક (૫) જનલોક (૬) તપલોક (૭) સત્યલોક અથવા બ્રહ્મલોક (૮) અતલ (૯) વિતલ (૧૦) સુતલ (૧૧) રસાતલ (૧૨) તલાતલ (૧૩) મહાતલ (૧૪) પાતાલ. આ ચૌદ ભુવનમાં વસતા દેવો તથા ઋષિવરોને નમસ્કાર.

૬૧. કરણ કલ્પના અનંત કરોડી દેવતાઓને નમસ્કાર : ત્રીસ ઘડીના સમયને કરણ કહે છે. કરણ અગીયાર છે. કલ્પ જગતના આયુષ્યોનો સમય, સો યુગ, બ્રહ્માનો એક દિવસ, ચાર યુગની એક ચોકડી એવી ૯૯૪ ચોકડી જેટલો સમય, ૪,૩૨૦,૦૦૦,૦૦૦ વર્ષનો સમય બ્રહ્મદેવે બ્રહ્માંડની રચના પોતાના કલ્પના બળથી કરેલી હોવાથી તેના દિવસને સંકલ્પ અથવા કલ્પના ઉપરથી કલ્પ કહે છે. એવા કરણ કલ્પમાં થઈ ગયેલ અનંત કરોડી દેવતાઓને નમસ્કાર.

સ્વામી અમારા અપરાધ ક્ષમા કરો, સત્‌પંથના માર્ગ માંહે રાખો, લખ ચોર્યાસીના ફેરા ટાળો, તેત્રીસ કરોડીના મેળા આપો, જાંબુદ્વિપના ધણી ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ

•••

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

Ramdasbapu Smrutidham - Pirana

realpatidar.com

પ.પૂ. બ્રહ્મલીન ગુરુવર્ય સંત ... તિથિ પ્રસંગે સત્સંગ - મહાપૂજા

પાવન સ્થળ : પ.પૂ. ગુરુવર્ય સંતશ્રી ... ાપીઠ - પીરાણા (તા. ૧૦-૫-૨૦૧૩)

પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતોનાં સ્વાગત - પૂજન

ધર્મસભામાં દીપ પ્રાગટ્ય

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુશ્રી તથા સંતો - મહંતો

ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા પ.પૂ. જગદ્‌ગુરુશ્રી

ઉપરોક્ત પ્રસંગે વારિયજ્ઞ - મહાપૂજા

ઉપરોક્ત પ્રસંગે વારિયજ્ઞ - મહપૂજાનો ધર્મલાભ લેતા શિષ્ય મંડળ - ભાવિક ભક્તજનો

realpatidar.com

https://archive.org/details/bk1409/page/n10/mode/1up

2013-06 -Satpanth Prakash (1409)

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18/05/2012.
Registered Under Postal Registration No. GAMC - 1830-2012-2014 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2014. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતુ માસિક

વિજ્ઞપ્તિ

શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરની નવીન માંડવડી (ગર્ભગૃહ) બનાવવા માટે મળો.

સંપર્ક : શ્રી બાબુભાઈ વાલજીભાઈ પટેલ - મો. ૯૪૨૬૦ ૫૭૬૪૬
મુ. ડુંગરપુર ફાર્મ, પો. તા. અમીરગઢ. જી. બનાસકાંઠા

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To,

Printed, and Published by **SHAMJIBHAI K. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset**, B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Premapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHAMJIBHAI K. PATEL**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com